

જા.ક. ૧૧૫/૨૦૧૬૧૭ – સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ તથા ૧૧૬/૨૦૧૬૧૭ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, વર્ગ-૩ સંવર્ગોની ભાગ-૨ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેની તારીખની જાહેરાત

મંડળ દ્વારા વિવિધ બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક:

(1) ૧૧૫/૨૦૧૬૧૭ – સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ (2) ૧૧૬/૨૦૧૬૧૭ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા.૦૭/૧૦/૨૦૧૮ ના રોજ યોજવામાં આવેલ હતી. ઉક્ત સ્પર્ધાત્મક લેખિત કસોટીને અંતે જે તે સંવર્ગમાં ભરવાની થતી જગ્યાઓના કેટેગરી વાઈઝ મેરીટના ધોરણે ક્વોલીફાય થયેલા ત્રણ ગણા ઉમેદવારોની ભાગ-૨ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે ઉમેદવારોની યાદી તા.૨૬/૧૨/૨૦૧૮ ના રોજ મંડળની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

જેમાં પસંદગી પામેલા જા.ક.૧૧૫/૨૦૧૬૧૭ ના ૨૦૧ ઉમેદવારોની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તારીખ ૦૪/૦૨/૨૦૧૯ ના રોજ યોજવાનું અને જા.ક.૧૧૬/૨૦૧૬૧૭ ના ૨૨૨ ઉમેદવારોની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તારીખ ૦૫/૦૨/૨૦૧૯ ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી.

કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ પરીક્ષાનું સ્થળ અને સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઈટ <https://gsssb.gujarat.gov.in> પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

:-કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટીના અભ્યાસક્રમ સંબંધમાં ઉમેદવાર માટેની સૂચનાઓ :-

(૧) કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી કુલ- ૭૫ ગુણની રહેશે. જેનો સમય ૧-૧૫ કલાકનો છે. આ કસોટીનો અભ્યાસક્રમ તથા ગુણભાર આ મુજબ છે.

- એક્સેલ સ્પ્રેડશીટ ૧૫ ગુણ,
- ઈ-મેઇલ કરવા (વીથ ફાઇલ એટેચમેન્ટ) ૧૫ ગુણ,
- પાવર પોઇન્ટ ૧૫ ગુણ,
- અંગ્રેજી ટાઇપીંગ, ગુજરાતી ટાઇપીંગ તથા વર્ડ ફોર્મેટીંગ ૩૦ ગુણ,

(૨) એક્સેલ સ્પ્રેડશીટ, ઈ-મેઇલ કરવા તથા પાવર પોઇન્ટ અંગ્રેજી ભાષામાં રહેશે અને પ્રશ્નપત્રની હાર્ડ કોપી આપવામાં આવશે પરંતુ ઈ-મેઇલમાં ફાઇલ એટેચમેન્ટ સોફ્ટ કોપીમાં રહેશે. વર્ડ ટાઇપીંગ ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં રહેશે અને તે અંગેના ફકરા હાર્ડ કોપીમાં આપવામાં આવશે, વર્ડ ફોર્મેટીંગ ફકરો અંગ્રેજી ભાષામાં અને સોફ્ટ કોપીમાં રહેશે પરંતુ કમાન્ડ હાર્ડ કોપીમાં આપવામાં આવશે. પ્રશ્નપત્ર પરીક્ષા પૂર્ણ થયા બાદ નિરીક્ષક (ઇન્વીજીલેટર)શ્રી ને ફરજિયાતપણે પરત કરવું. પ્રશ્નપત્ર કે તે અંગેની માહિતી ઉમેદવારને પરીક્ષા બાદ કોઇ પણ તબક્કે આપવામાં આવશે નહિં. પ્રશ્નપત્ર પરત નહિ કરનાર ઉમેદવારનાં માર્ક્સ ગણતરીમાં લેવામાં આવશે નહિ.

(૩) આ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) ટેસ્ટ માઇક્રોસોફ્ટ ઓફીસ ૨૦૦૭ ના વર્ઝન (Version) માં લેવામાં આવશે. કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) ટેસ્ટમાં ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતી અને માઇક્રોસોફ્ટ ઈન્ડીક લેન્ગવેજ ઈનપુટ ટુલ-૩ રહેશે. આ સોફ્ટવેરમાં આઠ (૮) કી-બોર્ડ ઉપલબ્ધ છે.

- (1) Gujarati Transliteration,
- (2) Gujarati Typewriter,
- (3) Gujarati Typewriter (G),
- (4) Gujarati Inscript,
- (5) Gdrej India,
- (6) Penington India,
- (7) Special Characters
- (8) Gujarati Terafont